

તા.૦૧/૧૨/૨૦૨૧

પ્રતિ,
તંત્રીશ્રી,
દૈનિક.....

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૧/૧૨/૨૦૨૧ના રોજ
વોર્ડ નં.૯માં નવનિર્મિત કોમ્યુનિટી હોલનું “અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ”
નામકરણ અનાવરણ વિધિ રાજ્યના માન. પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના
વરદ હસ્તે કરવામાં આવ્યું.

અભયભાઈ ખરા અર્થમાં તેમના નામ પ્રમાણે “અભય” હતા:

“માણસ કેટલું જીવ્યો તેના કરતા કેવું જીવ્યો તે મહત્વનું છે” આ કહેવતને
અભયભાઈએ સાર્થક કરેલ છે:

પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

અભયભાઈ સ્પષ્ટ વક્તા હતા અને તેમના નામ પ્રમાણે તેઓ સિંહ જેવી ગર્જના
ધરાવતા હતા: મેયર ડૉ.પ્રદિપ ડવ

અભયભાઈનું સામાજિક ક્ષેત્રે પ્રદાન અને કર્મ આપણને હંમેશા યાદ રહેશે:

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૧/૧૨/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૯માં
નવનિર્મિત કોમ્યુનિટી હોલનું “અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ” નામકરણ અનાવરણ

વિધિ રાજ્યના માન. પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન.મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, બક્ષી પંચ મોરયાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે. મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, શહેર ભાજપ મંત્રી રક્ષાબેન વાચડા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય જાગૃતિબેન ભાણવડીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, ઇંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, વોર્ડ પ્રભારી ડૉ.જૈમનભાઈ ઉપાધ્યાય, પ્રમુખ પ્રદિપભાઈ નિર્મળ, મહામંત્રી હિરેનભાઈ સાપરીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ તેમજ ભારદ્વાજ પરિવારના સભ્યશ્રીઓ તથા જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ નામાંકિત વકીલો તેમજ સ્થાનિક આગેવાનો વિગેરે ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે રાજ્યના માન.પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, વ્યક્તિનું નામ અમર રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ “અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ” નામકરણ કરેલ છે તે બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવેલ. વિશેષમાં, તેમણે જણાવેલ કે, જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે પરંતુ માણસ કેટલું જીવ્યો તેના કરતા કેવું જીવ્યો તે ખૂબ મહત્વનું છે. અભયભાઈએ આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરેલ છે. તેમના જીવનમાંથી ખરેખર પ્રેરણા મળી રહી છે. અભયભાઈ કાયદાકીય જ્ઞાન પણ ખુબ જ ધરાવતા હતા. દેશના પ્રધાનમંત્રી શ્રી

નરેન્દ્રભાઈ મોદી પણ કાયદાકીય માર્ગદર્શન માટે અભયભાઈના સંપર્કમાં રહેતા. અભયભાઈ ભારદ્વાજ ભગવાન પરશુરામની જેમ ખુબ જ ગુસ્સો ધરાવતા. પરંતુ, તેઓનો ગુસ્સો થોડી ક્ષણો માટે જ રહેતો. કારણ કે, અભયભાઈ સત્યને વળગી રહેનાર, સ્પષ્ટ વક્તા અને હિંદુ ભાવના ધરાવતા હતા. અભયભાઈ વિશાળ હૃદયના અને વિચારશીલ પણ હતા. તેઓ વિકાસ અને રાજનીતિની કુનેહ ધરાવતા હતા. તેઓના કાયદાકીય સુઝબુઝને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તેઓની લો કમિશનમાં તેમજ બાદમાં રાજ્ય સભાના સાંસદ તરીકે નિમણુંક કરવામાં આવેલ. પરંતુ શપથ લીધાના થોડા સમયમાં તેઓએ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધેલ. બ્રહ્મસમાજના સંગઠન માટે ખુબ જ મોટું યોગદાન આપેલ અને અભયભાઈએ “જય પરશુરામ” નો નારો ગુંજતો કરેલ હતો. માન.પુર્વ મુખ્યમંત્રીશ્રીએ કોલેજ સમયથી રાજ્યસભાના સાંસદ સુધીના અભયભાઈ સાથેના પોતાના સંસ્મરણો યાદ કરેલ હતા.

આ પ્રસંગે માન.મેયરશ્રીએ જણાવેલ કે, અભયભાઈનું નામ જ એવું હતું કે જેમાં સિંહ જેવી ગર્જના હતી. સત્યની બાબતમાં તેઓ સ્પષ્ટ વક્તા હતા. ભારતીય જનતા પાર્ટીમાં તેમનો સિંહ ફાળો હતો અને ભાજપને વટવૃક્ષ બનાવવામાં તેમનો ખૂબ મોટું યોગદાન હતું. વકીલાતના ક્ષેત્રે પણ તેઓએ ખુબ જ નામના મેળવેલ અને નાનામા નાના વકીલની વાત સાંભળતા. અભયભાઈ રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારે રાજકોટના વિકાસના અનેક સ્વપ્નો જોયેલા પરંતુ ખુબ જ ટૂંકા સમયમાં આપણા વચ્ચેથી વિદાય લીધેલ જે દુઃખદ ઘટના છે.

વિશેષમાં, માન.મેયરશ્રી જણાવેલ કે રૂ.૮.૫૮ કરોડના ખર્ચે આ નવનિર્મિત કોમ્યુનિટી હોલ બનાવેલ છે. જેમાં ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર ૭૦૦ વ્યક્તિની ક્ષમતા ધરાવતો તેમજ એક હોલ સેન્ટ્રલી એસી બનાવવામાં આવેલ તેમજ વર-વધૂના રૂમ સહિતની અદ્યતન સુવિધા આપેલ છે. અભયભાઈનું વ્યક્તિત્વ અને

વિચારધારા કાયમી અમર રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ કોમ્યુનિટી હોલનું નામકરણ કરી તેઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવેલ છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાએ કોમ્યુનિટી હોલનું અભયભાઈ સાથે નામ જોડેલ છે તે બદલ ધન્યવાદને પાત્ર છે. જન્મ પછી પોતાના જીવનકાળ દરમ્યાન કરેલ કર્મો માણસ છોડતો જાય છે. તે કર્મો માણસ કાયમી યાદ કરે છે. અભયભાઈએ સામાજિક ક્ષેત્રે કરેલ કર્મો માણસો આપણે હંમેશા યાદ રાખીશું. અભયભાઈના કર્મો કાયમી ચિરંજીવી રહેશે. અભયભાઈ જનસત્તા દૈનિક પત્રમાં રિપોર્ટર હતા અને અંગ્રેજી ઉપર સારું પ્રભુત્વ ધરાવતા હતા. બાબભાઈ જશુભાઈ પટેલના સમયે જનતા પક્ષ વખતે યુવા મોરચાના તેઓએ વિચાર આપેલ અને યુવાનોનું રાજકીય ક્ષેત્રે યોગદાન મળી રહે તે માટે જનતા પક્ષમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુવા મોરચાની સ્થાપના કરેલ. તેમજ ધારાશાસ્ત્રી તરીકે તેમણે ખુબજ નામના મેળવેલ હતી અને ગોવિંદભાઈ પટેલએ અભયભાઈ સાથેના સંસ્મરણો વાગોળેલ હતા.

કાર્યક્રમના પ્રારંભમાં પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં નામકરણની તકતી અનાવરણ કરેલ. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કરેલ જ્યારે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા અને સભ્યશ્રી સંજયસિંહ રાણાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. કાર્યક્રમના અંતે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ આભારવિધિ કરેલ.

(પી.એ. ટુ મેયર)